

25th March, 2019

To,
BSE Limited,
P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Scrip Code: 539921, Security ID: SEIL

Dear Sir,

SUB: Notice of Extra-Ordinary General Meeting published in newspapers.


Pursuant to the Regulation 47(3) of SEBI (Listing Obligation and Disclosure Requirements), 2015, Please find attached enclosed herewith the copy of newspaper advertisement published on 23rd March, 2019 in English and Gujarati language in 'The Indian Express' and 'The Financial Express' respectively, regarding Extra-Ordinary General Meeting to be held on 15th April, 2019.



You are requested to take the same on your records.

Thanking you,

Yours faithfully,

For Shanti Educational Initiatives Limited


Darshan Vayeda
Whole-Time Director
DIN: 07788073



Shanti Educational Initiatives Limited : (CIN : L80101GJ1988PLC010691)

Registered Office : 283, New Cloth Market, Raipur Ahmedabad - 380 002 | info@sei.edu.in | www.sei.edu.in

Corporate Office : Mondeal Square, A Wing, 6th Floor, Prahladnagar, Ahmedabad - 380015 | Land Line No.: 079 66177266

RECOGNITION OF RIGHTS OVER FOREST RESOURCES

More claims rejected than accepted: TISS

KAVITHA IYER
MUMBAI, MARCH 22

OF ALL claims filed by forest-dwelling communities seeking recognition of rights over forest resources as guaranteed by the Forest Rights Act, 2006, rejected claims outnumber recognised claims. In addition, no consolidated database exists on how many rejected claims went in for appeals as per the law, and how many claims were rejected again at the appeal stage, finds a report released by Tata Institute of Social Sciences on Friday.

The report has been compiled by faculty members and research scholars of TISS, who have been documenting the implementation and impact of the Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act, 2006, across India. It comes at a time when forest-dwelling communities in pockets across the country face uncertainty in the aftermath of the Supreme Court's February 13 order, later stayed, to evict forest dwellers whose claims were rejected.

According to the report, 44.83 per cent of all claims filed were accepted, while 45.90 per cent of all claims were rejected. In addition, 9.27 per cent claims remain pending.

In total, forest rights have been granted for only 15.29 per cent of the minimum potential forest area where rights can be recognised.

The Act recognises the historical injustice suffered by STs and Other Traditional Forest Dweller (OTFD) communities and seeks to restore the rights of such communities over land resources. Previous studies have pegged the forest land over which forest dwellers' rights may be recognised at over 100 million acres in 1.70,000 villages — a quarter of India's villages.

On the very large number of rejected and pending claims, the report notes that claimants are routinely not given in writing the reasons for rejection; the sub-di-

HIGHLIGHTS OF THE REPORT

■ Data from 2012-2018 shows that recognition of forest rights slowed down after a sharp spurt in general election year (June 2013 - May 2014) and the subsequent year (June 2014 - May 2015). A total of 3,47,383 forest right titles were recognised during these two years — 55.03 per cent of total titles recognised between June 2012 and November 2018.

■ Odisha, Chhattisgarh, Madhya Pradesh, Tripura and Maharashtra are the top five states in recognising Individual Forest Rights (IFR) — 70.62 per cent of total recognised IFR claims and 70.07 per cent of recognised IFR area in the country

■ Madhya Pradesh, Chhattisgarh, Maharashtra, Odisha and Gujarat are the top five states in recognising Community Forest Rights (CFR). They constitute 87.44 per cent of total recognised CFR claims and 80.10 per cent of recognised CFR area in the country

■ Chhattisgarh, Madhya Pradesh, Maharashtra, Karnataka and Odisha are the top five states for rejected IFR claims (71.50 per cent of total rejected IFR claims)

■ Madhya Pradesh, West Bengal, Chhattisgarh, Karnataka and Andhra Pradesh are the top five states for rejected CFR claims (76.53 per cent of total rejected CFR claims)

■ States affected by left wing extremism constitute 81.08 per cent of the total recognised forest right claims and 85.86 per cent of recognised forest area in the country

visional level committees (SDLC) and district level committees (DLC) do not make serious efforts to procure required documents and information for gram sabhas to file their claims; regular meetings of SDLC and DLC do not take place; and claims of the OTFDs are arbitrarily rejected or not processed, provisions for recognising OTFDs' rights routinely misinterpreted and misunderstood.

"These and several other reasons have not been discussed and brought to the notice of Supreme Court in the ongoing petition challenging the claims of forest dwellers," the report states. "In the light of above problems in the implementation

of the Act, it is very important to revisit the current mechanisms and institutional arrangements in addressing the increasing number of rejected and pending claims"

"While previous reports have documented reasons for ineffective implementation of the law, the effort this time is a country-wide comparison of various states in recognising forest rights claims and addressing pending and rejected claims. The report also has a special focus on Scheduled V states and states affected by left wing extremism (LWE)," said Geetanjoy Sahu, assistant professor at TISS School of Habitat Studies, and co-author of the report.

Before New Zealand shooting, Indian visitors nearly doubled in four years

SHUBHAJIT ROY
NEW DELHI, MARCH 22

THE DEATH of five Indian nationals among the 50 killed in the Christchurch terrorist attack has brought into focus another set of numbers that reveals how New Zealand is increasing becoming an attractive destination for visitors from India — they add up to a 93 per cent hike in the last four years.

Known for its beautiful locales, quality of higher education, low corruption and clean air, New Zealand has a population of 47 lakh of which around 2 lakh are Indians and those of Indian origin. But it's the number of Indians visiting the country that's telling.

According to data available with the New Zealand government, 34,672 Indian nationals visited New Zealand between September 2013-October 2014. This number has since increased steadily and now stands at 67,072 between September 2017 and October 2018.




A makeshift memorial outside the Al Noor Mosque in Christchurch, New Zealand, on Thursday. Reuters

While 70 to 80 per cent visit New Zealand for vacationing, and visiting family and friends, the remaining 20 per cent is linked to business, education and conferences.

The data also show that India is the second largest source of students to the country — after China — with over 30,000 Indian students. And in 2018, India was ranked ninth among the top 10 countries in terms of visitors to

INDIANS VISITING NZ



New Zealand, which includes all nationalities. Australia, China and the US were the top three "source countries".

New Zealand is a hot destination for Indians. Students go there for high-quality global education," says Deepali Patel, a licensed immigration advisor for New Zealand.

"Comparatively, I have to use the word comparatively after the latest incident in Christchurch, it is a very safe and

peaceful place. For girls who travel alone, it is very safe. There is no racial discrimination there," she says.

The number of students, however, has dropped in the last few years, particularly in the second half of 2016 and in 2018, due to tighter rules and monitoring of student visa applications from India.

According to Patel, New Zealand "wants high quality students", and it is offering a good deal for those who want to do their Masters and PhDs. "The spouse gets work visa, and a child above 5 years is treated as a domestic student, which means that its education is almost free," says Patel, who was earlier with the New Zealand High Commission's visa section.

Rajni Garg, another New Zealand government-licensed immigration advisor, says that before the year 2000, New Zealand was not high on the radar. "The Bollywood movie, 'Kaho Na Pyar Hai', which was shot in New Zealand, changed

that. After that, tourists started going there," Garg said.

"There is clean air, no crowds, only sheep and cows if one drives for miles, so there is solitude. And it is very immigrant-friendly. I recently came across a well-off Delhi-based businessman, who wants to migrate since his children are suffering due to air pollution," says Garg, who was also with the High Commission's visa section.

In 2016, New Zealand was ranked second in the Ease of Doing Business index, and in 2018 was ranked the second least corrupt country in the world according to Transparency International. It also ranks first in political freedoms, according to international rankings.

So will the Christchurch attack have an impact on visitors from India? "I don't think so," says Patel. "In New Zealand, volcanoes and earthquakes are an issue. Terrorism is not. This is not the Kiwi way, they will move on," says Garg, adding that her children are settled there.

Gujarat Pollution Control Board
Paryavaran Bhavan, Sector 10 A, Gandhinagar 382 010
Tel: 079-23232152 Fax: 079-23222784, www.gpcb.gujarat.gov.in

Public Notice

It is hereby to inform that as per public notice published in daily News paper **The Indian Express** dated 22/02/2019, public hearing of proposed project **M/s Adani Cementation Limited, at Lakhpat Cement Works for Integrated Limestone Mine Area 251.9 Ha, Clinkerization Plant (10 MTPA), Cement Plant (10 MTPA), Captive Power Plant (99 MW) including coal based Thermal Power Plant & Waste Heat Recovery System, Berthing jetty of length 820mx28m (Capacity 19 MTPA) and conveyor corridor (10.2km), at Village. Koriyani, Kapurasi, Maldo, Mudhva, Ta. Lakhpat, Dist. Kutch, category 'A' is scheduled to be held on 26.03.2019 at 11:00 hrs, Venue: Village: Koriyani (Gram Panchayat), Opposite Chamansinh Sodha's Bethak, Ta. Lakhpat, Dist. Kutch-370627, Public hearing is time being postponed due to unavoidable circumstances.**

Place: Gandhinagar Date: 19.03.2019 K. C. Mistry Member Secretary

DEBTS RECOVERY TRIBUNAL - II, CHANDIGARH
(GOVT. OF INDIA, MINISTRY OF FINANCE)
SCO 33-34-35, SECTOR-17A, CHANDIGARH
Area of Jurisdiction-Satate Haryana & Chandigarh (UT)

AUCTION NOTICE
(Proclamation of sale under rule 38 and rule 52(2) of the Second Schedule to the Income Tax Act, 1961 read with The Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993 as amended from time to time)

Title of Case & R.C. No	Recoverable Amount	Reserve Price	Earnest Money	Date & Time of Auction	Name of Court Auctioneer
Oriental Bank Of Commerce Vs. M/s Bansal Syndicate etc. RC No. 213/2018	Rs. 7,69,97,532.20 Jointly and severally, with costs, current and future simple interest @ 12.00% p.a. from the date of filing of the OA being the date of realization	Rs. 2,22,93,000/-	Rs. 55,73,250/-	30.04.2019 from 11:00 A.M. at the site of the property 23.12.2016, till the date of realization	Mr. B.S. Gill Chief Manager Oriental Bank Of Commerce Mob. 94667-00107

DETAILS OF PROPERTY TO BE SOLD
Industrial Plot, Survey No. 22, Paiki-2, Near Pine India, Village Chudva, Taluka Gandhidham, Distt. Kachchh, Gujrat. Owned by:
1. M/s Bansal Syndicate, Timber Merchants, Timber Market, Karnal (Haryana) through its Prop. Sh. Saurabh Bansal.
2. Sh. Saurabh Bansal Son of Sh. Subhash Bansal, R/o K. No. 2422, Sector -13, Karnal (Haryana).
3. Sh. Sanjay Bansal Son of Megh Raj Bansal, R/o K. No. 2422, Sector -13, Karnal (Haryana).
4. Sh. Subhash Bansal Son of Megh Raj Bansal, R/o K. No. 2422, Sector -13, Karnal (Haryana).

TERMS & CONDITIONS:- 1. Property are sold on "AS IS WHERE IS BASIS". 2. The prospective bidders should submit a Demand Draft (DD) favouring Recovery Officer, Debts Recovery Tribunal-II, Chandigarh as earnest money along with the bio-data giving their Name Address & Identity proof with photograph viz Photocopies of PAN Card, Voter Card etc. before the start of auction. All the bidders to remain present in person on the date of auction. After finalization of bidding, the DD of the highest bidder will be retained by the auctioneer and the DDs. of other bidders will be returned without interest thereon. The successful bidder will have to deposit 25% of highest bid amount after adjustment of earnest money already deposited by way of DD favouring "Recovery Officer, Debts Recovery Tribunal-II, Chandigarh" on the spot. The successful bidders shall also deposit postage fee @ 2% on first Rs. 1000/- and @ 1% on balance of highest bid in the spot by way of DD favouring Registrar-DRT-II, Chandigarh. In case of failure of deposit of balance amount the earnest money deposited will be forfeited. The highest bidder will have to deposit the remaining 75% of the said bid amount within 15 days from the date of auction. In case of failure, entire earnest money plus 25% of the highest bid amount will be forfeited. The sale will be confirmed by the Recovery Officer, DRT-II, Chandigarh after 30 days from the date of auction subject to the conditions laid down in 2nd schedule to the Income Act, 1961 read with RDOB and FI Act, 1993. All the outstanding, statutory dues/taxes will be borne by the purchaser. Other terms & conditions will be as laid down in the proclamation of sale and further subject to the Provisions of 2nd schedule to the Income Tax Act of 1961. For any other further information, contact the undersigned or Court Auctioneers Mr. B.S. Gill, Chief Manager, Oriental Bank Of Commerce, Recovery Cluster, SCO NO. 13-14, Sector-8, Karnal, (Haryana) Mobile No. 94667-00107. The undersigned will not be responsible for any - error/misstatement omission on the proclamation.

Recovery Officer-I DRT-II, Chandigarh

AGL
ASIAN GRANITO INDIA LIMITED
Regd. off : 202, Dev Arc, Opposite Iskon Temple, Ahmedabad GUJARAT 380015
CIN : L17110GJ1995PLC027025, Phone No. : 07966125500
Email: cs@aglasiangranito.com, Website: www.aglasiangranito.com

CORRIGENDUM

This has reference to the notice dated 6th March, 2019 convening the Extra-Ordinary General Meeting of the Shareholders of M/s. Asian Granito India Limited to be held on 5th April, 2019 at 10.30A.M. at AMACOMPLEX, ATIRA, Dr. Vikram Sarabhai Marg, Ahmedabad - 380015, Gujarat (herein after referred as 'Notice'), for seeking your approval for matters contained in the said Notice. The following alteration/modification in the Notice are hereby notified through this corrigendum to all the shareholders.

- Resolution No.1 of the Notice of EGM: Due to typographical error, the name of the proposed allottee at Sr. NO.6 in the table below the first Para of the Resolution is mentioned as Mr. Chhotubhai B. Patel instead of Chhotubhai B. Patel HUF. As such the following modification in the Resolution No.1 is required:

Sr. No.	Name	Category	No. of convertible warrants
6	Chhotubhai B. Patel (HUF)	Non- Promoter	4,00,000

- Accordingly in view of modification in the Resolution No.1 as stated in point No.1 above, the following modification is required in Sr. No. 9 of Item No.1 of Explanatory Statement to the Notice:

Sr. No.	Name & Address of the proposed allottees	Category	PAN	Identity of ultimate beneficial owners	No. & % of Equity Shares held prior to the Preferential Allotment		No. & % of Warrants to be issued and allotted		No. & % of Post Issue Equity and Voting Share Capital *(Assuming full conversion of of 50,00,000 convertible Warrants into equity Shares)	
					No. of Shares	%	No. of Warrants	%	No. of Shares	%
6	Mr. Chhotubhai B. Patel (HUF) Address: National Pharma Machinery, 11 Varahi Estate, Near Gota Rly, Crossing, Gota, Ahmedabad, India 382481.	Non-Promoter	AACHC5295H	Mr. Chhotubhai B. Patel (Karta), Hetalben C. Patel, Yesha C. Patel, Vrushank C. Patel	12,399	0.04	4,00,000	8.00	4,12,399	1.18

- Due to typographical error, the following modification is also required in last column of the heading of table in Sr. NO.8 and 9 of Item NO.1 of Explanatory Statement to the Notice respectively which should be read as under:
Post Issue Equity Holdings (assuming full conversion of 50,00,000 convertible Warrants)

No. & % of Post Issue Equity and Voting Share Capital *(Assuming full conversion of 50,00,000 convertible Warrants into equity shares)

- Due to typographical error, the word 'Special' is mentioned instead of 'Ordinary' in the para below the table in Item No.5 of Explanatory Statement to the Notice and the said para of recommendation of resolution is read as under:

Your Directors recommend Ordinary Resolution at Item No. 5 of the Notice, in relation to approval of Related Party Transactions.

The changes proposed in this corrigendum is no way resulting any change in management control. This Corrigendum should be read in continuation of and in conjunction with notice of Extra Ordinary General Meeting sent to the shareholders.

This corrigendum and the Notice of EGM shall be placed before the shareholders in the ensuing Extra Ordinary General Meeting to be held on 5th April, 2019 for their approval.

This corrigendum along with the Notice is also being placed at the website of the company www.aglasiangranito.com and at the website of the stock exchanges where the shares of the company are listed.

By the order of the Board of Asian Granito India Limited

Mr. Kamleshbhai B. Patel
Chairman and Managing Director
DIN: 00229700

Place : Ahmedabad
Date : 22/03/2019

SHANTI EDUCATIONAL INITIATIVES LIMITED
CIN: L80101GJ1988RPO10691
Reg. Office : 283, New Cloth Market, Raipur, Ahmedabad-380002
Corporate Office : Mondeal Square, A Wing, 6th Floor, Prahladnagar, Ahmedabad-380015
Contact No. +079 66177266, +91 9099004846
Email: info@seil.edu.in, Website: www.seil.edu.in

NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION

This is to bring to your notice that:

- The Extra-ordinary General Meeting of the members of Shanti Educational Initiatives Limited ("the Company") will be held on Monday, 15th day of April, 2019 at 05:30 P.M. at 6th Floor, Chirpal House, Near Shivranjani Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat, India.
- Electronic copy of the notice of EGM, has been sent to all members whose e-mail IDs are registered with Company/ DP. Physical copy of the notice of EGM have been sent to all other members at their registered address in the printed mode. The dispatch of the notice has been completed on 20.03.2019.
- Members holding the shares either in physical form or in dematerialized form, as on cut-off date of 08.04.2019, may cast their vote electronically from a place other than venue of EGM (Remote E-voting), through the e-voting services provided by CDSL, on the resolution set out in the notice of the EGM. All the members are informed that:
 - The Business as set out in the notice of the EGM may be transacted through e-voting.
 - The voting period commences on 9:00 A.M. on Thursday, 11th April, 2019 and ends at 5.00 P.M. on Sunday, 14th April, 2019. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.
 - Once a member casts vote on a resolution, he/she will not be allowed to modify his/her vote.
 - The facility for voting either through electronic voting system or ballot or polling paper shall also be made available at the EGM and members attending EGM who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right at the EGM.
 - The Members who have cast their votes by remote e-voting may also attend the EGM but shall not be entitled to cast their vote again.
 - A person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintained by depositories after as on cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the EGM.
 - Any person who acquires shares of the company after dispatch of notice and holding share on cut-off date may obtain their log in ID and password by sending request at helpdesk.evoting@cdslindia.com.
 - M/s. Parikh dave & Associates, Practicing Company Secretaries has been appointed as scrutinizer to conduct the E-voting process in fair and transparent manner.
 - In case of any queries with voting, members may contact CDSL at toll free number 18002005533 and e mail to helpdesk.evoting@cdslindia.com or contact company on info@seil.edu.in.
- The Notice of EGM is displayed on company's website www.seil.edu.in and on website of CDSL www.evotingindia.com. Members can download the same from above websites or can request company at the registered office or at info@seil.edu.in

For, Shanti Educational Initiatives Ltd
Sd/-
Darshan Vayeda
Whole-Time Director
DIN : 07788073

Place: Ahmedabad
Date : 20th March, 2019

WESTERN RAILWAY - VADODARA DIVISION
E-TENDER NOTICE
COMMERCIAL DEPARTMENT
1. Tender No.: CA450-AKV-Zone-A-19 dated 19.03.2019. Name of Work/Tender for the contract for display of commercial advertisement by way of hoardings and sign boards media under publicity zone-A in the Circulating Area (East & West Side) of Ankleshwar Railway Station in the total area of 1252 sq. ft. for the period of 05 years. 3. Location: Circulating area of Ankleshwar Railway Station 4. Media: Hoarding & Sign Board 5. Total area: 1252 sq. ft. 6. Reserve Price: Rs. 2,44,530/- for 1st year + GST 7. Earnest money Deposit: Rs. 26,000/- Earnest Money Deposit shall be accepted only through online net banking or E-payment Gateway 8. Tender form fee: Rs. 2,360/- (Including GST @ 18%) Cost of tender shall be accepted only through online net banking or E-payment Gateway 9. Period of Contract: 05 years 10. Closing date & time of tender: 15.04.2019 at 15.00 hrs 11. Opening date & time of tender: 15.04.2019 at 15.30 hrs 12. Website particulars: Through online website www.treps.gov.in only
Like us on: facebook.com/WesternRly

WESTERN RAILWAY - VADODARA DIVISION
E-TENDER NOTICE
COMMERCIAL DEPARTMENT
1. Tender No.: CA450-BH-Zone-A-19 dated 19.03.2019 2. Name of Work: Tender for the contract for display of commercial advertisement by way of hoardings and sign boards media in the Circulating Area (East & West side) and by way of Hoardings at Shaktinath under pass in the Railway premises of Bharuch Railway Station in the total area of 3268 sq. ft. for the period of 05 years. 3. Location: Circulating area of Shaktinath under pass of Bharuch Railway Station 4. Media Hoarding & Sign Board 5. Total area: 3268 sq. ft. 6. Reserve Price: Rs. 7,16,070/- for 1st year + GST 7. Earnest money Deposit: Rs. 76,100/- Earnest Money Deposit shall be accepted only through online net banking or E-payment Gateway 8. Tender form fee: Rs. 3,540/- (including GST @ 18%) Cost of tender shall be accepted only through online net banking or E-payment Gateway 9. Period of Contract: 05 years 10. Closing date & time of tender: 15.04.2019 at 15.00 hrs 11. Opening date & time of tender: 15.04.2019 at 15.30 hrs 12. Website particulars: Through online website www.treps.gov.in only
Like us on: facebook.com/WesternRly

ભારતે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કર્યું છે : અમેરિકા

પીટીઆઇ
વોશિંગ્ટન, તા. ૨૨
અમેરિકાએ વેનેઝુએલા પર મુકેલા પ્રતિબંધો પર ભારત અમેરિકાને સહકાર આપી રહ્યું છે અને ટ્રમ્પ વહીવટીતંત્ર એવું સમજે છે કે ભારતની ખાનગી કંપનીઓએ લેટિન અમેરિકન દેશમાંથી ઓઇલની આયાત કરવાનું અટકાવી દીધું છે, તેમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. વોશિંગ્ટનને વેનેઝુએલાન પ્રમુખ નિકોલસ મડુરોના શાસન સામે પગલાઓ વધાર્યા છે, તે સમયે યુએસ અધિકારીની આ ટિપ્પણી આવી પડી છે, નિકોલસ દેશમાં ભારે વિરોધ અને

આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે શાસન પર ટકી રહેવા ઝડપી રહ્યા છે. ભારતને ઓઇલ સપ્લાય કરનારો વેનેઝુએલા ત્રીજો સૌથી મોટો દેશ છે, ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ વપરાશકાર દેશ છે. ટ્રમ્પ વહીવટીતંત્રના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, મારી સમજણ એવી છે કે ભારતીય ખાનગી કંપનીઓ- કે જેઓ વેનેઝુએલાન ઓઇલની આયાત કરતી હતી તેઓએ હવે આ આયાત અટકાવી દીધી છે. આવી કંપનીઓ, અમેરિકામાં પણ હિત ધરાવે છે, તેઓ યુએસ પ્રતિબંધોની અવગણના કરે તેવી સંભાવના નથી, તેમ તેમણે બુધવારે રિપોર્ટર્સને જણાવ્યું હતું.

સત્તાધીશ શાસન સામે યુએસના પ્રયત્નોને ભારતનો પ્રતિભાવ એ બાબતે પુછાયેલા પ્રશ્નો જવાબ આપતાં, અધિકારીએ જણાવ્યું હતું કે ભારત આ બાબતે યુએસને સહકાર આપી રહ્યો છે. ખાનગી કંપનીઓને સંદેશાવ્યવહારમાં ભારતીયોને સહકાર રહ્યો છે.

ઇયુએ બ્રેકિંગમાં વિલંબ માટે વિકલ્પો ઓફર કર્યા એએફપી
બ્રુસેલ્સ, તા. ૨૨
યુરોપિયન નેતાઓ અને બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે ગુડ વારે બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી છૂટાછેડા લેવા બાબતે થોડો વિલંબ થાય અને વ્યવસ્થિત બ્રેકિંગની આશા બાબતે સંમત થયા હતા. ૨૯મી માર્ચ સુધીમાં બ્રેકિંગ માટે બ્રિટન ભારે મુશ્કેલી અનુભવી રહ્યું છે, પરંતુ તેમને ઇયુ સાથીદારોને જણાવ્યું હતું કે જો બ્રિટીશ સાર્વેશિય વિયોલેન્સ કરારને આગામી સપ્તાહમાં મંજૂર કરે તો, આવા બંધાણ માટે ૨૨મી મે સુધી પ્રતિજ્ઞા કરી શકાય છે. પરંતુ થોડી ઘડિયાળ ઓફ કોમન્સ આ કરારને અટકાવે તો- જે અગાઉ બે વાર બની ચુક્યું છે-તો બ્રેકિંગ ૧૨મી એપ્રિલ થશે, જો બ્રિટન બાદમાં એવો નિર્ણય ન લે કે તે આ વર્ષની યુરોપિયન સંસદીય ચૂંટણીઓમાં ભાગ લેશે. યુરોપિયન સંસદીય ચૂંટણી યોજવી કે કેમ તેનો નિર્ણય લેવા માટે યુકે માટે ૧૨ એપ્રિલ મહત્વની તારીખ છે, તેમ ઇયુ કાઉન્સિલના પ્રમુખ અને સમિતિના આયોજક ડેનાલ્ડ ટસ્કે આ વ્યવસ્થાની જાહેરાત કરતા જણાવ્યું હતું.

શાંતિ એજ્યુકેશન ઇનિશીએટીવ્સ લિમિટેડ

CIN: L80101GJ1988PLC010691
રજિસ્ટર્ડ ઓફિસ : ૨૮૩, ન્યુ ક્લોથ માર્કેટ, રામપુર, અમદાવાદ, ગુજરાત- ૩૮૦૦૦૨
કોર્પોરેટ ઓફિસ : માનડ્રીલ સ્કવેર, એ વિંગ, છબ્રે માળ, પ્રહલાદનગર, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૧૫
સંપર્ક નં. : +૦૭૯-૬૬૧૭૨૨૬૬, +૯૧ ૯૦૮૯૦૦૪૮૪૬
ઇમેઇલ : info@seil.edu.in, વેબસાઇટ : www.seil.edu.in

એક્સટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ અને રીમોટ ઇ-વોટિંગ માહિતીની નોટિસ

તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે:

- શાંતિ એજ્યુકેશન ઇનિશીએટીવ્સ લિમિટેડ (કંપની)ના સભ્યોની એક્સટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ સોમવાર, ૧૫મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ સાંજે ૦૫:૩૦ વાગે દુબૈમાં, ચિરીપાલ હાઉસ, શિવરંજની કોસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫, ગુજરાત, ભારત ખાતે રાખેલ છે.
- ઇજોએમની નોટિસન ઇલેક્ટ્રોનિક નક્કલ તમામ સભ્યોને જેમના ઇમેઇલ આઇડી કંપની/ ડિપોઝિટરી પાસે રજીસ્ટર્ડ હતા તેમને મોકલવામાં આવી છે અને ઇજોએમની નોટિસની ફીઝીકલ નક્કલ તમામ સભ્યોને તેમના સરનામાં પર પ્રીન્ટેડ સ્વરૂપે મોકલવામાં આવી છે. નોટિસની રવાનગી ૨૦.૦૩.૨૦૧૯ના રોજ પૂર્ણ કરવામાં આવી છે.
- કટઓફ તારીખ એટલે કે ૦૮.૦૪.૨૦૧૯ના રોજ ફીઝીકલ સ્વરૂપે અથવા ડિપોઝિટરીના ઇમેઇલ સ્વરૂપે શેરો ધરાવતા હોય તે સભ્યો સીડીએસએલ દ્વારા પુરી પડાયેલ ઇ વોટિંગ સેવાઓ મારફત ઇજોએમની નોટિસમાં જણાવેલ કરાવો પર ઇજોએમના સ્થાન સિવાય અન્ય સ્થાનેથી ઇલેક્ટ્રોનિક રીતે તેમના મતો આપી શકે છે. તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે:
 - ઇજોએમની નોટિસમાં જણાવ્યા અનુસાર કાર્યો ઇ-વોટિંગ મારફત પાર પાડવામાં આવશે.
 - મતદાનનો સમયગાળો ૧૧ એપ્રિલ, ૨૦૧૯, ગુરુવારના રોજ સવારે ૯:૦૦ વાગે શરૂ થશે અને ૧૪ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સાંજે ૫.૦૦ વાગે પૂર્ણ થશે.
 - એક વખત સભ્યો કરાવે ઉપર મત આપે ત્યાર બાદ તે/તેણીને મતમાં ફેરફાર કરવાની પરવાનગી મળશે નહીં.
 - ઇલેક્ટ્રોનિક મતદાન પદ્ધતિ અથવા બેલોટ અથવા પોલિંગ પેપર બંને મારફત મતદાનની સુવિધા ઇજોએમ ખાતે ઉપલબ્ધ કરાવામાં આવશે અને સભ્યો જેમણે પહેલેથી રીમોટ ઇ-વોટિંગ મારફતે તેમના મતો આપ્યા નથી તેઓ ઇજોએમ ખાતે તેમના હક્કનો ઉપયોગ કરવા પાત્ર બનશે.
 - સભ્યો જેમણે તેમના મત રીમોટ ઇ-વોટિંગથી આપ્યા છે તેઓ ઇજોએમમાં પણ હાજરી આપી શકશે પરંતુ તેમના મત ફરીથી આપવા હકદાર ગણાશે નહીં.
- કટઓફ તારીખના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરી દ્વારા સંચાલીત બેનિફિસીયલ ઓનરના રજીસ્ટરમાં જે વ્યક્તિના નામ નોંધાયેલ છે ફક્ત તેજ રીમોટ ઇ-વોટિંગ અથવા ઇજોએમ ખાતે મતદાનની સુવિધા મેળવવા માટે હકદાર ગણાશે.
- એક વ્યક્તિ જેણે નોટિસની રવાનગી પછી કંપનીના શેરો મેળવ્યા છે અને કટઓફ તારીખના દિવસે શેરો ધરાવે છે તે helpdesk.evoting@cdslindia.com પર વિનંતી મોકલેલો લોગિન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે.
- એચ. મે. પરિખ દ્વારા એન્ડ એસોસિયેટ્સ, પ્રેક્ટીસીંગ કંપની સેક્ટરીની યોગ્ય અને પારદર્શક રીતે ઇ-વોટિંગ પ્રક્રિયાના સંચાલન માટે સ્કુટીના ઇજાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- આઇ) મતદાન અંગે કોઇપણ પ્રશ્નોના કિસ્સામાં સભ્યો સીડીએસએલનો ટોલ ફ્રી નંબર. ૧૮૦૦૨૦૦૫૩૩૩ પર સંપર્ક કરી શકે છે અને helpdesk.evoting@cdslindia.com પર ઇમેઇલ કરી શકે છે અથવા કંપનીનો info@seil.edu.in પર સંપર્ક કરી શકે છે.
- ઇજોએમની નોટિસ કંપનીની વેબસાઇટ www.seil.edu.in અને સીડીએસએલની વેબસાઇટ helpdesk.evoting@cdslindia.com પર મુકવામાં આવી છે. સભ્યો તે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે અથવા કંપનીને તેની રજીસ્ટર્ડ ઓફિસ અથવા info@seil.edu.in પર વિનંતી કરી શકે છે.

શાંતિ એજ્યુકેશન ઇનિશીએટીવ્સ લિમિટેડ
સહી-
દર્શન વાઘેડા
ડિરેક્ટર
રચણા: અમદાવાદ
તારીખ: ૨૦મી માર્ચ, ૨૦૧૯
ફોન : ૦૭૯૮૦૭૩

(This is only an advertisement for information purposes and not a prospectus announcement.)

OSIA HYPER RETAIL LIMITED

CIN: U52190GJ2013PLC077269

Our Company was originally incorporated in Ahmedabad as "Maple Exim Private Limited" on October 18, 2013 under the provisions of the Companies Act, 1956 vide certificate of incorporation issued by the Registrar of Companies, Dadra and Nagar Haveli, Gujarat. Our Company was converted into a Public Limited Company and consequently the name was changed to "Maple Exim Limited" vide fresh certificate of incorporation dated August 08, 2017 issued by the Registrar of Companies, Ahmedabad, Gujarat. Further, the name of the company was from "Maple Exim Limited" to "Osia Hyper Retail Limited" with effect from September 13, 2017. For more details, please see section titled "History and Certain Corporate Matters" on page 119 of the Prospectus.

Registered Office: Basement Store 1, 4d Square, Opp. IIT Eng College, Nr. D-Mart, Visat Gandhinagar Highway, Motera, Ahmedabad - 380005, Gujarat India.
Tel No.: +91-8460604015 | **E-mail:** cs2013.ohr@gmail.com | **Website:** www.osiahypermart.com
Contact Person: Ms. Keerthi Laxman Lachhwani (Company Secretary & Compliance officer)

THE ISSUE

PUBLIC ISSUE OF 15,78,400 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH OF OSIA HYPER RETAIL LIMITED ("OUR COMPANY" OR "THE ISSUER") FOR CASH AT A PRICE OF ₹ 252 PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ 242 PER EQUITY SHARE) ("ISSUE PRICE") AGGREGATING TO 3977.57 LAKHS ("THE ISSUE"), OF WHICH 79,200 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH FOR A CASH PRICE OF ₹ 252 PER EQUITY SHARE, AGGREGATING TO ₹ 199.6 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER ("MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION I.E. ISSUE OF 14,99,200 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH AT AN ISSUE PRICE OF ₹ 252 PER EQUITY SHARE AGGREGATING TO ₹ 3777.98 LAKHS IS HEREAFTER REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 26.52 % AND 25.18 %, RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY. FOR FURTHER DETAILS, PLEASE REFER TO SECTION TITLED "TERMS OF THE ISSUE" BEGINNING ON PAGE 205 OF THE PROSPECTUS.

THIS ISSUE IS BEING MADE IN TERMS OF CHAPTER IX OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018 ("THE SEBI ICDR REGULATIONS"), AS AMENDED. THIS ISSUE IS A FIXED PRICE ISSUE AND ALLOCATION IN THE NET ISSUE TO THE PUBLIC WILL BE MADE IN TERMS OF REGULATION 253 OF THE SEBI (ICDR) REGULATIONS, 2018, AS AMENDED. FOR FURTHER DETAILS, PLEASE REFER TO SECTION TITLED "ISSUE PROCEDURE" BEGINNING ON PAGE 215 OF THE PROSPECTUS.

THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹ 10 EACH AND THE ISSUE PRICE IS ₹ 252 THE ISSUE PRICE IS 25.2 TIMES OF THE FACE VALUE.

ISSUE CLOSING ON: TUESDAY, MARCH 26, 2019

CLOSES ON: THURSDAY, MARCH 28, 2019

ASBA* Simple, Safe, Smart way of Application - Make use of it !!!

*Applications Supported by Blocked Amount (ASBA) is a better way of applying to issues by simply blocking the fund in the bank account, investors can avail the same. For details, check section on ASBA below.
Mandatory in Public Issues from January 01, 2016 No cheque will be accepted.

UPI now available in ASBA for retail individual investors.

*ASBA is a better way of applying to issues by simply blocking the fund in the bank account. For further details check section on ASBA below. "ASBA has to be availed by all the investors except anchor investors. UPI may be availed by retail individual investors. For details on the ASBA and UPI Process, please refer to the details given in ASBA form and Abridged Prospectus. The process is also available on the website of AIBI and Exchange in the General Information Document." ASBA application forms can be downloaded from the website of National Stock Exchange and can be obtained from a list of banks that is displayed on the website of SEBI at www.sebi.gov.in. List of banks supporting UPI is also available on the website of SEBI at www.sebi.gov.in. HDFC Bank Limited has been appointed as Sponsor Bank for the Issue, in accordance with the requirements of the SEBI Circular dated November 01, 2018.

PROMOTERS : MR. DHIRENDRA GAUTAM CHOPRA AND MRS. KAVITA DHIRENDRA CHOPRA

PROPOSED LISTING: The Equity Shares offered through this Prospectus are proposed to be listed on the Emerge Platform of National Stock Exchange of India Limited ("NSE" i.e. "NSE Emerge Platform"). In terms of the Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, as amended, we are required to obtain an in-principle listing approval for the shares being offered in this issue. Accordingly, our Company has received an in-principle approval letter dated March 14, 2019 from NSE for using its name in this offer document for listing of our shares on the Emerge Platform of NSE. For the purpose of this Issue, the Designated Stock Exchange will be the NSE.

DISCLAIMER CLAUSE OF SEBI: Since the Issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Draft Offer Document was not filed with SEBI. In terms of the SEBI Regulations, the SEBI shall not issue any observation on the Offer Document. Hence, there is no such specific disclaimer clause of SEBI. However, investors may refer to the entire "Disclaimer Clause of SEBI" on page 196 of the Prospectus.

DISCLAIMER CLAUSE OF NSE EMERGE PLATFORM (DESIGNATED STOCK EXCHANGE): It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Prospectus has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the Prospectus. The investors are advised to refer to the Prospectus for the full text of the "Disclaimer Clause of NSE EMERGE PLATFORM" on page 199 of the Prospectus.

IPO GRADING: Since the Issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations 2018, there is no requirement of appointing an IPO Grading agency.

ADDITIONAL INFORMATION AS REQUIRED UNDER SECTION 30 OF COMPANIES ACT, 2013

MAIN OBJECTS AS PER MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY: 1. To carry on all or any of the businesses of buyers, sellers and distributors, agents or dealers, importers and exporters (whether by wholesale, retail or otherwise) in all kinds of Handlooms, handicrafts, cottage industry and household products handmade textiles, handmade sculptors, toys and other preparations accessories of every description and other materials or things capable of being used in connection therewith.

AMOUNT OF SHARE CAPITAL AND CAPITAL STRUCTURE: Authorized Share Capital of ₹ 7,00,00,000 divided into 70,00,000 equity shares of ₹ 10 each. Subscribed and Paid-up capital prior to the issue is ₹ 4,37,50,000 divided into 43,75,000 equity shares of ₹ 10 each. Proposed Post-issue share capital: ₹ 5,95,34,000 divided into 59,53,400 equity shares of ₹ 10 each.

LIABILITY OF MEMBERS: The liability of members is limited upto the extent of shares allotted to them.

Names of the Signatories of Memorandum of Association of the Company and number of shares subscribed by them are (1) Mr. Dhirendra Gautam Chopra: 5,000 Equity Shares (2) Ms. Kavita Dhirendra Chopra: 5,000 Equity Shares.

CORRIGENDUM: NOTICE TO INVESTORS

In relation to the Prospectus dated March 18, 2019, it is clarified that only retail individual investors can apply in the Issue through the UPI Mechanism. The above notice is required to be read in conjunction with the Abridged Prospectus and General Information Document.

LEAD MANAGER TO THE ISSUE	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
 MONARCH NETWORK CAPITAL LIMITED (Earlier known as Networth Stock Broking Limited) MONARCH HOUSE, Opp. Ishwar Bhawan, Commerce Six Roads, Navrangpura, Ahmedabad - 380014, India Ph. : (+91) 79-26666500, 66000500 Website: https://www.mnclgroup.com Email: jenny.bagrecha@mnclgroup.com Investor Grievance Email: mbd@mnclgroup.com Contact Person: Ms. Jenny Bagrecha SEBI Regn. No.: INM000011013	 SKYLINE FINANCIAL SERVICES PRIVATE LIMITED 4A9, Gundecha Onclave, Kherani Road, Sakinaka, Mumbai - 400072, India. Tel. No. : 022 - 28511022/ 62215779 Website: www.skylinert.com Email: Mumbai@skylinert.com Investor Grievance Email: grievances@skylinert.com Contact Person: Mr. Subhash Dhingreja SEBI Regn. No.: INE000032341	 OSIA HYPER RETAIL LIMITED Ms. Keerthi Laxman Lachhwani Basement Store 1, 4d Square, Opp. IIT Eng College, Nr. D-Mart, Visat Gandhinagar Highway, Motera, Ahmedabad - 380005, Gujarat India. Tel. No. : +91-8460604015, E-mail: cs2013.ohr@gmail.com Website: www.osiahypermart.com Investors can contact the Company Secretary and Compliance officer or the Registrar in case of any Pre-Issue or Post-Issue related problems such as non-acceptance of letters of allotment, credit of allotted equity shares in the respective beneficiary account, etc.

AVAILABILITY OF APPLICATION FORMS: Application forms can be obtained from the registered office of the Company: OSIA HYPER RETAIL LIMITED, Lead Manager: MONARCH NETWORK CAPITAL LIMITED and the collection centers of the Banker to the Issue: HDFC Bank Limited. Application Forms can also be obtained from the Stock Exchange and the list of SCSSBs available on the website of SEBI at www.sebi.gov.in. The Application forms can also be downloaded from the website of Stock Exchange i.e. www.nseindia.com.

AVAILABILITY OF PROSPECTUS: Investors should note that Investment in Equity Shares involves a degree of risk and investors are advised to refer to the Prospectus and the Risk Factors contained therein, before applying in the Issue. Full copy of the Prospectus will be available at the website of Stock Exchange i.e. www.nseindia.com, the website of Lead Manager at www.mnclgroup.com and the website of the Company at www.osiahypermart.com.

APPLICATIONS SUPPORTED BY BLOCKED AMOUNT (ASBA): All Investors shall apply through the ASBA process only. The investors are required to fill the form and submit the same to the relevant SCSSB or the Registered Brokers at Broker Center or the RTA or the CDP. The SCSSB will block the amount in the account as per the authority contained in the form. On allotment, amount will be unblocked and account will be debited only to the extent required to be paid for allotment of shares. Hence, there will be no need of refund. For more details please refer to the details given in application form, general information document and the section "Issue Procedure" on page 215 of the Prospectus.

All capitalized terms not specifically defined herein will have the same meaning as attributed to such terms in the Prospectus.

SPONSOR BANK AND BANKER TO THE ISSUE: HDFC Bank Limited

For **OSIA HYPER RETAIL LIMITED**
On behalf of the Board of Directors
Sd/-
Mr. Dhirendra Gautam Chopra
Managing Director

OSIA HYPER RETAIL LIMITED is proposing, subject to market conditions, public issue of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Ahmedabad. The Prospectus is available on the website of the Stock Exchange i.e. www.nseindia.com, the website of the Lead Manager at www.mnclgroup.com and the website of the Company at www.osiahypermart.com. Investors should note that investment in Equity Shares involves a high degree of risk. For details investors should refer to and rely on the Prospectus including the section titled "Risk Factors" beginning on page 19 of the Prospectus, which has been filed with ROC. The Equity Shares have not been and will not be registered under the US Securities Act (the "Securities Act") or any state securities law in United States and may not be issued or sold within the United States or to, or for the account or benefit of, "U.S. persons" (as defined in the Regulations under the Securities Act), except pursuant to an exemption from, or in a transaction not subject to the registration requirements of the Securities Act of 1933.

મુથુટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ : ટીસીએઓ. ૧૪/૨૦૦૪-૦, મુથુટ નેબર, પુષ્પોલ સેડ,
વિશ્વવત્સુલ-૬૫૫ ૦૩૪, CIN : U65922KL2010PLC025624
કોર્પોરેટ ઓફિસ : ૧૨/એ ૧૧, ૧૩મો માળ, પાસીલી કેસલેન્ડો, પ્લોટ નં. સી૩૮ અને ૩૯,
બાંધા કુલા હોમલેન્ડ-૧૭ બ્લોક (ઇસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૧ ફોન નં. : ૦૨૨-૬૨૨૮૫૦૦

માંગણા નોટિસ

ઇસિસ્ટોરીટાઇઝેશન અને રીફાઇન્સિંગ ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ, ૨૦૦૨ની કલમ ૧૩(૨)ને સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (નિયમો) ૨૦૦૨ના નિયમ ૩ સાથે સંબંધિત હેલ્થ નોટિસ

જન જણાવવાનું કે મુથુટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની લિ.ના નીચે સહી કરનાર ઓધોરાઇઝ્ડ ઓફિસરે સિક્યોરીટીટાઇઝેશન અને રીફાઇન્સિંગ એક્ટ હેઠળના નિયમો અન્વયે એનફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ એક્ટ, ૨૦૦૨ હેઠળ અને કલમ ૧૩(૨)ને સિક્યોરીટી ઇન્વેસ્ટમેન્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વાંચીને મળેલી સત્તાની ફેરો નીચે જણાવેલ કરજદાર, સહ કરજદાર(રો), ગેરેટર(રો)ને માંગણા નોટિસ જારી કરી તેમને જારી કરાયેલ લાગતી બાંધકામ નોટિસમાં તારીખ થી ૬૦ દિવસની અંદર લાગતી વળગતી નોટિસમાં જણાવેલ રકમો ચૂકવી જવા માટે જણાવ્યું હતું જે ઉપરોક્ત અનુસંધાનમાં નીચે પણ આપાયેલ છે. પરિણામે એક વખત ફરીથી જણાવેલ કરજદાર, સહ-કરજદાર(રો) અને ગેરેટરને આ નોટિસના પ્રકાશનની તારીખથી ૬૦ દિવસની અંદર મુથુટ હાઉસિંગ ફાઇનાન્સ કંપની લિમિટેડને ચૂકવવાની કરી જવા નોટિસ આપવામાં આવે છે, અહીં નીચે જણાવેલ કરજદાર(રો) દ્વારા કરાયેલ લોન ઓફિસરને અને દસ્તાવેજો/ લખાણો જે કોઇ હોય તો તેની સાથે વાંચન હેઠળ ચૂકવવાની અને અથવા છુટકારાની તારીખ સુધી નીચે જણાવેલ તારીખ(ઓ)થી જણાવેલ માંગણા નોટિસમાં દર્શાવ્યા અનુસાર પ્રતિ વર્ષ ૧૮ ટકાના દરે અને વ્યાજ સહીત રકમો જણાવેલ છે. લોનની પુનઃકવણી માટે સિક્યોરીટી તરીકે નીચેની સિક્યોરીટી ઓફરેબલ ઇક્વિટીએલને જણાવેલ કરજદાર, સહ-કરજદાર(રો), ગેરેટર(રો) મારફત અનુક્રમ મોર્ગેજ કરવામાં આવી છે.

ક્રમ નં.	કરજદાર / સહ-કરજદાર / ગેરેટરનું નામ	માંગણા નોટિસની તારીખ	કુલ બાકી લેણાની રકમ	સિક્યોર્ટી એસેટ(રો) / સ્થાવર મિલકત (નો નો વ્યાજ/)
1	કેન કાલિલાલ પંચોલી પુષ્પેન પંચોલી Loan A/c No :-16500062791	૩૧-૦૧-૨૦૧૯	૨૩-૦૧-૨૦૧૯ નો રોજ ₹. ૭૩૩૩૬૬.૪૮	૨૪ જ ૨૮, સર્વે. ૧૮૩, વિનાયક વિલા રેસીડેન્સી, બ્લોક નં. ૨૮, મોરબી રોડ, રામ મંદિર સામે, રાજકોટ, એચ.ઓ. ગુજરાત-૩૬૦૦૦૧
2	કેન કાલિલાલ પંચોલી પુષ્પેન પંચોલી Loan A/c No :-16500077606	૩૧-૦૧-૨૦૧૯	૨૩-૦૧-૨૦૧૯ નો રોજ ₹. ૨૧૨૨૬૦.૫૫	બ્લોક નં. ૨૮, વિનાયક વિલા, મહાદેવ મંદિર, રાજકોટ-મોરબી રોડ પર, હાઇવે, ગાંધી સ્કૂલ પાછળ, એચ.ઓ. રેસીડેન્સી, ચંદ્રમોલેશ્વર પાછળ, રતનપર, સિદ્ધસ્તાન પેટ્રોલ પંપ પાછળ, રાજકોટ, ગુજરાત-૩૬૦૦૦૧
3	અબ્દુલ અજીઝ મુનિર લિમ્બ પ્રવાલા બિન્દીશ અજીઝ લિમ્બ પ્રવાલા Loan A/c No :-11650075215	૧૫-૦૨-૨૦૧૯	૧૪-૦૨-૨૦૧૯ નો રોજ ₹. ૭૪૫૭૪.૨૩	સર્વે નં. એસ. રીવેન્યુ સર્વે ૬૬૬/૧, સીટી સર્વે નં. ૧૫૭ ક્લેટ ૩૦૧, સર્વે નં. ૫૮૪૩, ૫૮૪૪ અને, ઉમ્મેદીયલ એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, કમલા, કમલા, ૫૪૩ની હોસ્ટેલ પાસે, નવસારી, નવસારી એચ.ઓ. ગુજરાત-૩૬૬૪૪૫.
4	સોનાલીબેન ભાસ્કરદાસ ધાવાર ભાસ્કરદાસ લલિતાબાઇ ધાવાર Loan A/c No :-16100007986	૧૫-૦૨-૨૦૧૯	૧૪-૦૨-૨૦૧૯ નો રોજ ₹. ૪૪૧૨૨.૭૫	જીવેન્યુ સર્વે નં. ૧૮૬, બ્લોક નં. ૨૨૪, પટેલ પાર્ક, પ્લોટ નં. ૧ થી ૪, જેના પર માલમળી કોમ્પ્લેક્સ બંધાયેલ છે, ત્રીજો માળ, ક્લેટ નં. ૩૦૫, મોજે કોલ્ડ, પલ્લણા જિલ્લો સુરત ૩૬૪૩૩૨
5	માંગણા નોટિસ અબ્દુલમુબિન શાહ જુબેદ સાયિદ Loan A/c No :-11137078526	૨૬-૧૨-૨૦૧૯	૨૬-૧૨-૨૦૧૯ નો રોજ ₹. ૭૭૬૫૦.૫૫	જીવેન્યુ સર્વે નં. ૨૦૩, બીજો માળ, બિલીંગ નં. જે/૧, અને ઉમાર રેલ્વે કોલિંગ પોઇન્ટ, ગોધાવર સપ્લાયવોડ, સપ્લાય, બલિદ ધારા રેસીડેન્સી, સુરત, સારર ઇન્ડસ્ટ્રીયલ, માંચોળા, ગુજરાત ૩૬૪૧૩૦
6	માંગણા નોટિસ ઉકામણા મહાધાન મુખેશ મહાધાન Loan A/c No :-16100010188	૨૬-૧૨-૨૦૧૯	૨૬-૧૨-૨૦૧૯ નો રોજ ₹. ૪૧૯૮૨.૨૩	જીવેન્યુ સર્વે નં. ૧૦૩, પહેલો માળ, સ્વામીદાસ એપાર્ટમેન્ટ, બાબા રામદેવ એપાર્ટમેન્ટ સામે, વલ્લભનગર સોસાયટી પાછળ, યોગીદાસ સોસાયટી, છાપ્રાબા, સુરત
7	માંગણા નોટિસ રામલાલપાન પાલવપાન સિદ્ધાંતી પાલવપાન Loan A/c No :-16100072397	૨૬-૧૨-૨૦૧૯	૨૬-૧૨-૨૦૧૯ નો રોજ ₹. ૩૪૨૬૭.૦૫	જીવેન્યુ સર્વે નં. ૧૮૬, બ્લોક નં. ૨૨૪, પટેલ પાર્ક, પ્લોટ નં. ૧ થી ૪, જેના પર માલમળી કોમ્પ્લેક્સ બંધાયેલ છે, ત્રીજો માળ, ક્લેટ નં. ૩૦૫, મોજે કોલ્ડ, પલ્લણા જિલ્લો સુરત ૩૬૪૩૩૨
8	માંગણા નોટિસ ધર્મેશ ચુરેશ મુખામયા Loan A/c No :-16100080837	૨૬-૧૨-૨૦૧૯	૨૬-૧૨-૨૦૧૯ નો રોજ ₹. ૭૪૫૭૪.૨૩	જીવેન્યુ સર્વે નં. ૧૮૬, બ્લોક નં. ૨૨૪, પટેલ પાર્ક, પ્લોટ નં. ૧ થી ૪, જેના પર માલમળી કોમ્પ્લેક્સ બંધાયેલ છે, ત્રીજો માળ, ક્લેટ નં. ૩૦૫, મોજે કોલ્ડ, પલ્લણા જિલ્લો સુરત ૩૬૪૩૩૨
9	માંગણા નોટિસ અબ્દુલ અજીઝ મુનિર લિમ્બ પ્રવાલા બિન્દીશ અજીઝ લિમ્બ પ્રવાલા Loan A/c No :-1165008080	૦૮-૦૩-૨૦૧૯	૦૮-૦૩-૨૦૧૯ નો રોજ ₹. ૩૭૫૭૪.૨૩	૩૦૧, ઉમ્મેદીયલ એપાર્ટમેન્ટ, કમલા રોડ, યશવિન હોસ્ટેલ પાસે, નવસારી, ગુજરાત-૩૬૬૪૪૫

જો જણાવેલ કરજદાર, સહ-કરજદાર(રો) અને ગેરેટર(રો)ને ઉપર જણાવેલ રકમની પુનઃકવણી કરવામાં નિષ્ફળ જશે તો, એમએચએફસીએલ ઉપરોક્ત સિક્યોર્ટી એસેટ(રો) સામે કાયદાની કલમ ૧૩(૨)